



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૮/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૩૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૦ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૬૯ લીટર દેશી દારૂ, ૨૪૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૧ ક્વોટર ઇંગ્લીશદારૂ, ૫૪૩ બીયરટીન, ૦૨ સ્કુટર, ૦૧ રીક્ષા અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૯ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૫૪,૭૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૩૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૩૩૬/૧૯

નારોલ : મહેશભાઈ પવનકુમાર અગ્રવાલ (રહે.ધ સેવન રાજેન્દ્ર સોસાયટી, ભેરવનાથ રોડ મણીનગર) એ તા.૭/૮/૧૯ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને-૨૦૧૮ થી તા.૦૩/૦૭/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી મહેન્દ્રભાઈ રમણકુમાર પરમાર (રહે. પાંચમો માળ, નર્મદા સોસાયટી, રીલાયન્સ પેટ્રોલ પંપની ગલી વસ્ત્રાલ) તથા અન્ય મદદગારોએ ભેગામળી મહેશભાઈની કંપનીમાં નોકરી દરમ્યાન નડીયાદ દેવ એન્ટરપ્રાઇઝ માંથી મંગાવેલ લાકડા પેટે ચૂકવણીના કુલ રૂપિયા ૨૦,૬૪,૯૭૦/- ના ચેકો લઈ જઈ, તે ચેક દેવે એન્ટરપ્રાઇઝ ને નહી આપી તમામ ચેકો પોતાના ખાતામાં જમા કરાવી નાણા ઉપાડી લઈ મહેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૩૩૭/૧૯

વસ્ત્રાપુર : જાગૃતિબહેન વા/ઓ પ્રદીપભાઈ દેવે (ઉ.વ.૬૦)(રહે.તુલીપ બંગલોઝ ડ્રાઇવ-ઇન રોડ સુરધારા સર્કલ પાસે વસ્ત્રાપુર) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૦૮/૧૯ રાતના ૯/૩૦ થી તા.૦૭/૦૮/૨૦૧૯ ના કલાક ૮/૩૦ વાગ્યા દરમ્યાન વસ્ત્રાપુર ગોયલ ઇન્ટરસિટીથી નજીક સારથી-૩ બંગ્લોઝની સામે કિષ્ણા કોમ્પ્લેક્ષ મકાન નંબર-૧ નું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી રોકડ રૂપિયા ૫૦૦૦/-, સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૨,૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૧૫,૦૦૦/-મતાની ચોરી કરી લઈ ગઈ છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એલ.રબારી ચલાવે છે.

સેટેલાઈટ : રવીરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૬)(રહે.ક્રિસ એક્સ વાટીકા ફ્લેટ કાનબા હોસ્પિટલ પાસે નિકોલ) એ તા.૭/૮/૧૯ નારોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૬/૧૯ રાતના ૧૦/૦૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન ઈસ્કોન ચાર રસ્તા પાસે આવેલ વિજય સેલ્સ નામના શો-રૂમ ના બાથરૂમનો એક્ઝોસ ફેન તોડી, સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતા બે અજાણ્યા છોકરાઓ શો-રૂમમાં પ્રવેશ કરી, ડેમો એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૦૭ કુલ કિંમત રૂપિયા ૧,૨૨,૮૧૬/- મતાના ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.ગમારા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૩૮/૧૯

સેટેલાઈટ : સ્નેહલ મદદનલાલ ભટ્ટ (ઉ.વ.૪૩)(રહે.જીવનધામ ફ્લેટ, બીમાનગરની સામે સેટેલાઈટ) એ અગમ્ય કારણસર તા.૦૭/૦૮/૨૦૧૯ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે બેડરૂમમાં સાડી વડે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો. શ્રી વિક્રમસિંહ સામંતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.